

B.com - Sem - 6
Management Accounting - II

classmate

Date _____
Page _____

प्रश्न-1]

- | | | | |
|------------------|-------|--------|-------------------|
| ① → a | ⑪ → c | ②① → d | ③① → a |
| ② → b | ⑫ → c | ②② → c | ③② → b |
| ③ → d | ⑬ → c | ②③ → c | ③③ → c |
| ④ → a | ⑭ → d | ②④ → b | ③④ → b |
| ⑤ → a | ⑮ → b | ②⑤ → a | ③⑤ → a |
| ⑥ → a | ⑯ → b | ②⑥ → a | ③⑥ → c |
| ⑦ → b | ⑰ → c | ②⑦ → a | |
| ⑧ → b | ⑱ → d | ②⑧ → b | |
| ⑨ → a | ⑲ → d | ②⑨ → b | |
| ⑩ → b | ⑳ → c | ③⑩ → b | |

प्रश्न-2]

(1)

$$\begin{aligned} \text{आवसामान लाभ वियोग} &= \text{परिष्कार कर्षण (प्रभावी लाभ - परिष्कार लाभ)} \\ &= 110 \text{ रु. (5-6)} \\ &= 110 \times (-1) \end{aligned}$$

$$\text{आवसामान लाभ वियोग} = -110 \text{ अ. (प्रतिशत)}$$

(2) वार्षिक पञ्जीत उद्देश्य लावण्याची वेळी किमती व तेव्हाच मूळ (अधिकतर धारण करणे. लावण्याची दर वेळी येणे असल्याची सोपी, तेव्हा तेव्हाच मूळची किमती नीचली जाई.

(3) कर्षण पद्धतीने 7 रु.	300,000
लाई: 50% कर्षण	1,50,000
	<hr/> 1,50,000
+ धारणा (20,00,000 × 12.5%)	2,50,000
कुल मूल्य प्रचार देणे	<hr/> 4,00,000

$$\text{अधिकृत मूल्य} = \frac{20,00,000}{4,00,000} = \boxed{5 \text{ रु.}}$$

(4) 1-4-83 100 } 500
31-3-18 350 }

ચંચાની પડતર

100 → 50,000
350 → ?

1,75,000

— દરજી [1,75,000 × 10 × 500]

87,500

87,500

ચંચાની દરજીવાદ
પડતર

(5) ડેપોઝિટની પરીદશાકિતમાં થતા દરજી પ્રતિ
કુલાવો.

(6) નક્કી કરેલી પ્રમાણ પડતર અને ઉભાદન દરમિયાન
થયેલ પરિવર પદમાં જે લાકાવત જણાય છે તે પડતરનાં
વિચલન કહેવાય. જે પ્રમાણપદ્ય કરતાં પરિવર પદ્ય વધુ
વાય તે તે પ્રતિકૂળ વિચલન કહેવાય છે પરંતુ જે
પરિવર પદ્ય ઓછો વાય તે તે અનુકૂળ વિચલન
કહેવાય છે.

(7) મુદ્દી બેંકે કે મુદ્દી અંદાજપદા ભવિષ્યના સમય દરમિયાન
અપેક્ષિત મુદ્દીપદ્યના અંદાજની રજૂઆત કરે છે. ~~જે~~
મુદ્દે અને મોકિના બાબત મુજબ "મુદ્દી બેંકે 2 એ
મુદ્દીના રોકાણના પડતરવરત્ત જણાવેલ વનની નિર્ણય
ભાવની પ્રક્રિયા છે."